

Signature of Invigilators

Roll No.

1. **PHYSICAL EDUCATION**
2. **Paper II**

(In figures as in Admit Card)

Roll No.

(In words)

JY—04/21

Name of the Areas/Section (if any).....

Time Allowed : 75 Minutes]

[Maximum Marks : 100

Instructions for the Candidates

1. Write your Roll Number in the space provided on the top of this page.
2. This paper consists of *fifty (50)* multiple choice type questions. *All* questions are compulsory.
3. Each item has upto four alternative responses marked (A), (B), (C) and (D). The answer should be a capital letter for the selected option. The answer letter should entirely be contained within the corresponding square.

Correct method A Wrong Method A or A

4. Your responses to the items for this paper are to be indicated on the ICR Answer Sheet under paper II only.
5. Read instructions given inside carefully.
6. One sheet is attached at the end of the booklet for rough work.
7. You should return the test booklet to the invigilator at the end of paper and should not carry any paper with you outside the examination hall.

પરીક્ષાર્થીઓ માટેની સૂચનાઓ :

૧. આ પાનાની ટોચમાં દર્શાવેલી જગ્યામાં તમારો રોલ નંબર લખો.
૨. આ પ્રશ્નપત્રમાં કુલ **પચાસ (50)** બહુવૈકલ્પિક ઉત્તરો ધરાવતા પ્રશ્નો આપેલા છે. બધા જ પ્રશ્નો ફરજિયાત છે.
૩. પ્રત્યેક પ્રશ્ન વધુમાં વધુ ચાર બહુવૈકલ્પિક ઉત્તરો ધરાવે છે. જે (A), (B), (C) અને (D) વડે દર્શાવવામાં આવ્યા છે. પ્રશ્નનો ઉત્તર કેપીટલ સંજ્ઞા વડે આપવાનો રહેશે. ઉત્તરની સંજ્ઞા આપેલ પાનામાં બરાબર સમાઈ જાય તે રીતે લખવાની રહેશે.

ખરી રીત : A ખોટી રીત : A , A

૪. આ પ્રશ્નપત્રના જવાબ આપેલ ICR Answer Sheet ની Paper II વિભાગની નીચે આપેલ ખાનાઓમાં આપવાના રહેશે.
૫. અંદર આપેલ સૂચનાઓ કાળજીપૂર્વક વાંચો.
૬. આ બુકલેટની પાછળ આપેલું પાનું રફ કામ માટે છે.
૭. પરીક્ષા સમય પૂરો થઈ ગયા પછી આ બુકલેટ જે તે નિરીક્ષકને સોંપી દેવી. કોઈપણ કાગળ પરીક્ષા ખંડની બહાર લઈ જવો નહીં.

PHYSICAL EDUCATION

શારીરિક શિક્ષણ

PAPER-II

પ્રશ્નપત્ર-II

Note : (i) This paper contains fifty (50) multiple-choice/true or false, and matching type questions.

(ii) Attempt All the questions.

(iii) Each question carries two (2) marks.

નોંધ : (i) આ પ્રશ્નપત્રમાં પચાસ (૫૦) બહુવિકલ્પીય પ્રશ્નો, સાચું-ખોટું અને જોડકાં બનાવવાના પ્રશ્નો છે.

(ii) તમામ પ્રશ્નોના જવાબ લખવાના છે.

(iii) પ્રત્યેક પ્રશ્નના બે (૨) ગુણ છે.

1. What is the aim of Physical Education ?

(A) Physical Development

(B) Whole some development of an individual

(C) Growth and development

(D) Mental development

શારીરિક શિક્ષણનું ધ્યેય શું છે?

(A) શારીરિક વિકાસ

(B) વ્યક્તિનો સર્વાંગિક વિકાસ

(C) વૃદ્ધિ અને વિકાસ

(D) માનસીક વિકાસ

2. National Institute of sports, patiala was started in :

(A) 1956

(B) 1958

(C) 1960

(D) 1962

જેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ સ્પોર્ટ્સ, પતિયાલાની શરૂઆત થઈ :

(A) ૧૯૫૬

(B) ૧૯૫૮

(C) ૧૯૬૦

(D) ૧૯૬૨

3. Y.M.C.A. College of Physical Education, Chennai started in :

(A) 1920

(B) 1918

(C) 1922

(D) 1924

વાય.એમ.સી.એ. કોલેજ ઓફ ફિઝિકલ એજ્યુકેશન, ચેન્નાઈની શરૂઆત થઈ :

(A) ૧૯૨૦

(B) ૧૯૧૮

(C) ૧૯૨૨

(D) ૧૯૨૪

4. First Modern Olympic Games were held in :
 (A) 1890 (B) 1896
 (C) 1994 (D) 1888
 પ્રથમ આધુનિક ઓલિમ્પીક ક્યા વર્ષે યોજાયો હતો :
 (A) ૧૮૯૦ (B) ૧૮૯૬
 (C) ૧૯૯૪ (D) ૧૮૮૮
5. Who is called as hockey wizard ?
 (A) D. Pillay (B) Dhyan Chand
 (C) Trikey (D) Samir Dad
 હોકીના જાદુગર તરીકે કોણ ઓળખાય છે?
 (A) ડી. પીલ્લે (B) ધ્યાનચંદ
 (C) ટ્રાયકે (D) સમીરદાદ
6. If only two timings are available in running events and the disagree, which time will be considered ?
 (A) Both shall be official timings (B) Longer time
 (C) Shorter time (D) None of these
 દોડની સ્પર્ધામાં બે જ ઘડિયાળ સમય બતાવે છે બન્ને ઘડિયાળ અલગ સમય બતાવે છે કયો સમય નોંધવામાં આવશે :
 (A) બન્ને પ્રમાણભૂત સમય ગણાશે (B) વધારે સમય બતાવે તે ગણાશે
 (C) ઓછો સમય બતાવે તે ગણાશે (D) આમાંથી કોઈ નહીં
7. The best method of training of emotions in sports is :
 (A) Repression (B) Redirection
 (C) Supression (D) Sublimation
 રમતગમતમાં લાગણીની તાલિમ આપવાની શ્રેષ્ઠ પદ્ધતિ છે :
 (A) રીપ્રેશન (B) રીડાયરેક્સન
 (C) સપ્રેશન (D) સબ્લીમેશન
8. Acclimatization is the :
 (A) Physiological adaptation to environment
 (B) Constant exposure to climate
 (C) Exposure to high altitude
 (D) All of the above
 અનુકુલનતા એટલે :
 (A) વાતાવરણ સાથે શરીરવિજ્ઞાન અનુકુળતા
 (B) આબોહવા સાથે સતત સંપર્કમાં રહી શકવું
 (C) દરિયાની સપાટીથી ઉંચાઈએ રહેવું
 (D) ઉપરની બધીજ પરિસ્થિતિ

9. The body which controls the participation of the Indian teams in olympic games ?

- (A) A.A.F.I. (B) I.O.C.
(C) I.O.A. (D) O.C.A.

ઓલિમ્પીક રમતોમાં ભારતીય ટુકડીના ભાગ લેવા ઉપર નિયંત્રણ કરનાર મંડળ :

- (A) એ.એ.એફ.આઈ. (B) આઈ.ઓ.સી.
(C) આઈ.ઓ.એ. (D) ઓ.સી.એ.

10. When was the Lakhmibai National Institute of Physical Education Gwalior established ?

- (A) 1958 (B) 1957
(C) 1959 (D) 1960

લક્ષ્મિબાઈ નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ ફિઝિકલ એજ્યુકેશન ગ્વાલિયરની સ્થાપના કયા વર્ષે થઈ હતી :

- (A) ૧૯૫૮ (B) ૧૯૫૭
(C) ૧૯૫૯ (D) ૧૯૬૦

11. Who received 'Dronacharya' award ?

- (A) Prof. Karan Singh (B) Prof. S. Srivatsan
(C) Prof. Ajmer Singh (D) Prof. A. K. Singh

દ્રોણાચાર્ય એવોર્ડ કોણે મેળવ્યો છે :

- (A) પ્રો. કરણસીંગ (B) પ્રો. એસ. શ્રીવાત્સન
(C) પ્રો. અજમેરસીંગ (D) પ્રો. એ.કે. સીંગ

12. Whose definition of health is most acceptable ?

- (A) I.O.A. (B) W.H.O.
(C) S.A.I. (D) U.N.E.S.C.O.

સ્વાસ્થ્યની સર્વસ્વીકૃત વ્યાખ્યા આપનાર સંસ્થા :

- (A) આઈ.ઓ.એ. (B) ડબલ્યુ.એચ.ઓ.
(C) એસ.એ.આઈ. (D) યુ.એન.ઈ.એસ.સી.ઓ.

13. Which factor is *not* related with fitness ?

- (A) Strength (B) Stamina
(C) Flexibility (D) Cooperation

ક્ષમતા સાથે કયું પરિબળ સંબંધ ધરાવતું નથી :

- (A) તાકાત (B) સહનશક્તિ
(C) નમનિયતા (D) સહકાર

14. 'Supercompensation' means :
- (A) Fatigue (B) Second wind
(C) Adaptation to load (D) Oxygen debt
- “સુપર કોમ્પેનસેશન” એટલે :
- (A) થાક (B) સેકન્ડ વીન્ડ
(C) ભાર સાથે અનુકુલન (D) ઓક્સિજન દેવું
15. Sergeant jump measures :
- (A) Explosive leg strength (B) Agility
(C) Explosive arm strength (D) Endurance
- સાર્જન્ટ જમ્પ માપે છે :
- (A) સ્ફોટક પગ તાકાત (B) ચપલતા
(C) સ્ફોટક હાથ તાકાત (D) સહનશક્તિ
16. Shoulder joint is :
- (A) Hinge (B) Pivot
(C) Gliding (D) Ball and Socket
- ખભાનો સાંધો ઓળખાય છે :
- (A) હિંગ (B) પીવોટ
(C) ગ્લાઈડિંગ (D) બોલ એન્ડ સોકેટ
17. Factor affecting the pace or recovery are :
- (A) Nature of the Load (B) Health & Physical fitness
(C) Sleep (D) None of these
- પરત સામાન્ય સ્થિતિમાં આવવામાં અસર કરતું પરિબલ :
- (A) ભાર પ્રકાર (B) આરોગ્ય અને શારીરિક ક્ષમતા
(C) ઊંઘ (D) આમાંથી કોઈ નહીં
18. In rehabilitation of sports injuries, one of the following method is used :
- (A) Corrective exercise (B) Hydrotherapy
(C) Cryotherapy (D) None of these
- રમત ઈજાના પુનર્વેશન માટે નીચેનામાંથી કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે :
- (A) કરેક્ટીવ એક્સરસાઈઝ (B) હાઈડ્રોથેરેપી
(C) ક્રાયોથેરેપી (D) આમાંથી કોઈ નહીં
19. The study of muscles is called :
- (A) Osteology (B) Anthrology
(C) Myology (D) Neurology
- સ્નાયુનો અભ્યાસ ઓળખાય છે :
- (A) ઓસ્ટીયોલોજી (B) એન્થ્રોલોજી
(C) માયોલોજી (D) ન્યુરોલોજી

20. 'Shin Splint' occurs in :
 (A) Upper leg (B) Lower leg
 (C) Abdomen (D) Back
 'શીન સ્પ્લિન્ટ' થાય છે :
 (A) પગના ઉપરના ભાગે (B) પગના નીચેના ભાગે
 (C) પેટ (D) પીઠ
21. Sprain is an injury to :
 (A) Ligament (B) Muscle
 (C) Bone (D) Connective tissue
 સ્પ્રેઇન શેની ઈજા છે :
 (A) લીગામેન્ટની (B) સ્નાયુની
 (C) હાડકાંની (D) કનેક્ટીવ ટીસ્યુની
22. Introverts are interested in :
 (A) Themselves (B) Others
 (C) Themselves and others (D) None of these
 આંતરમુખી રસ ધરાવે છે :
 (A) પોતાનામાં (B) બીજામાં
 (C) પોતાની જાત અને બીજામાં (D) આમાંથી કોઈ નહીં
23. The word 'metabolism' is concern with :
 (A) Circulatory system (B) Digestive system
 (C) Respiratory system (D) Nervous system
 'મેટાબોલીઝમ' શબ્દ કોની સાથે જોડાયેલો છે :
 (A) સર્ક્યુલેટરી સીસ્ટમ (B) ડાયજેસ્ટીવ સીસ્ટમ
 (C) રેસ્પીરેટરી સીસ્ટમ (D) નર્વસ સીસ્ટમ
24. Stroke volume is concerned with :
 (A) Heart (B) Liver
 (C) Kidney (D) Spleen
 'સ્ટ્રોક વોલ્યુમ' સંબંધ ધરાવે છે :
 (A) હાર્ટ સાથે (B) લીવર સાથે
 (C) કિડની સાથે (D) સ્પ્લીન સાથે
25. Heart rate is defined as :
 (A) Quantity of blood pumped away by heart in one minute
 (B) Number of systolic contractions per minute
 (C) Number of diastolic contractions per minute
 (D) Number of heart contractions per minute
 હાર્ટ રેટની વ્યાખ્યા :
 (A) હૃદય દ્વારા એક મિનિટમાં ધકેલવામાં આવતો લોહીનો જથ્થો
 (B) એક મિનિટમાં સીસ્ટોલીક કોન્ટ્રેક્શનની સંખ્યા
 (C) એક મિનિટમાં ડાયસ્ટોલીક કોન્ટ્રેક્શનની સંખ્યા
 (D) એક મિનિટમાં હાર્ટ કોન્ટ્રેક્શનની સંખ્યા

26. Copper's 12 minutes run/walk test measures :
- (A) Speed (B) Cardio respiratory endurance
(C) Agility (D) Strength
- કુપરની ૧૨ મિનિટ દોડ/ચાલ કસોટી માપે છે :
- (A) સ્પીડ (B) કાર્ડિયો-રેસ્પીરટરી એન્ડ્યુરન્સ
(C) એજીલીટી (D) સ્ટ્રેન્થ
27. F-ratio is used to compare :
- (A) More than two standard deviations
(B) Less than two means
(C) More than two means
(D) None of the above
- F-રેશીયો તુલના કરવા માટે વપરાય છે :
- (A) બે કરતા વધુ સ્ટાન્ડર્ડ ડેવીએશનની (B) બે કરતા ઓછા મીન્સની
(C) બે કરતા વધુ મીન્સની (D) આમાંથી કોઈ નહીં
28. 'Fartlek Training' is used best to develop :
- (A) Flexibility (B) Strength
(C) Endurance (D) Neuromuscular coordination
- ફાર્ટલેક તાલિમ દ્વારા શ્રેષ્ઠ વિકાસ થાય છે :
- (A) નમનિયતાનો (B) તાકાતનો
(C) સહનશક્તિનો (D) ન્યુરો-મસ્ક્યુલર કો-ઓર્ડિનેશનનો
29. Factor influencing growth are :
- (A) Heredity (B) Nutrition
(C) Exercise (D) All of these
- વૃદ્ધિ પર અસર કરતું પરિબળ :
- (A) વારસો (B) પોષણ
(C) કસરત (D) આમાંના બધાજ
30. Which is *not* law of learning ?
- (A) Law of readiness (B) Law of effect
(C) Law of reaction (D) Law of exercise
- શીખવાનો નિયમ નથી :
- (A) લો ઓફ રેડીનેશ (B) લો ઓફ ઈફેક્ટ
(C) લો ઓફ રીએક્સન (D) લો ઓફ એક્સરસાઈઝ

31. The main purpose of a pilot study to Physical Education research is :
- (A) To obtain funds for subsequent research
 (B) To test and improve research plan
 (C) To provide opportunities for student to get research experiance
 (D) None of the above

શારીરિક શિક્ષણના સંશોધનમાં પાયલોટ અભ્યાસનો મુખ્ય ઉદ્દેશ :

- (A) આગળ સંશોધન માટે ભંડોળ એકત્રીત કરવા
 (B) સંશોધન યોજનાની કસોટી અને સુધારણા માટે
 (C) વિદ્યાર્થીઓને સંશોધન અનુભવની તક આપવા માટે
 (D) ઉપરનામાંથી કોઈ નહીં

32. The 't' test is used for :

- (A) Comparing five means (B) Comparing two means
 (C) Comparing three means (D) More than five means

'T' ટેસ્ટનો ઉપયોગ થાય છે :

- (A) પાંચ મીનની સરખામણી માટે (B) બે મીનની સરખામણી માટે
 (C) ત્રણ મીનની સરખામણી માટે (D) પાંચ કરતા વધુ મીનની સરખામણી માટે

33. Newton's second law of motion is called :

- (A) Law of Interaction (B) Law of inertia
 (C) Law of acceleration (D) Law of gravity

ન્યુટનનો ગતિનો બીજો નિયમ ઓળખાય છે :

- (A) આંતરક્રિયાનો નિયમ (B) જડત્વનો નિયમ
 (C) પ્રવેગનો નિયમ (D) ગુરૂત્વાકર્ષણનો નિયમ

34. Motor Skills are Learnt best by :

- (A) Imitation (B) Practice
 (C) Observation (D) Memorization

મોટર સ્કીલ્સ સારી રીતે શીખી શકાય છે :

- (A) અનુકરણ દ્વારા (B) મહાવરા દ્વારા
 (C) નિરીક્ષણ દ્વારા (D) યાદશક્તિ દ્વારા

35. Who gave the laws of learning ?

- (A) Watson (B) McDougall
 (C) H.C. Buck (D) Thorndike

શિખવાના નિયમોના પ્રણેતા :

- (A) વોટ્સન (B) મેકડુગલ
 (C) એચ.સી. બક (D) થોર્નડાઈક

36. First law of motion is called :
- (A) Law of action and reaction (B) Law of conservation of energy
(C) Law of inertia (D) Law of transfer of momentum
- ન્યુટનનો ગતિનો પહેલો નિયમ ઓળખાય છે :
- (A) આઘાત-પ્રત્યાઘાતનો નિયમ (B) શક્તિ-સંગ્રહનો નિયમ
(C) જડત્વનો નિયમ (D) ગતિમાન સંક્રમણનો નિયમ
37. Who among the following devised the test for the game Basket-ball ?
- (A) Broer-Miller (B) Schmithal
(C) Petry (D) Johnson
- નીચેનામાંથી બાસ્કેટબોલ રમત કસોટી તૈયાર કરી આપનાર કોણ :
- (A) બ્રોઅર-મિલર (B) સ્કેમીથલ
(C) પેટ્રી (D) જહોનસન
38. Psychology deals with :
- (A) Functions of body (B) Activities of mind
(C) Activities of soul (D) Movement of the man
- મનોવિજ્ઞાન સંબંધ ધરાવે છે :
- (A) શરીરની ક્રિયા સાથે (B) મનની પ્રક્રિયા સાથે
(C) આત્માની પ્રક્રિયા સાથે (D) માનવીના હલનચલન સાથે
39. Who invented laws of motion ?
- (A) Newton (B) Plato
(C) Aristotle (D) Einstien
- ગતિના નિયમો કોણે શોધ્યો?
- (A) ન્યુટને (B) પ્લેટોએ
(C) એરિસ્ટોટલ (D) એઈનસ્ટાઈન
40. In case of sprain, the immediate treatment recommended is :
- (A) Hydrotherapy (B) Ice therapy
(C) Heat therapy (D) None of these
- સ્પ્રેઈન વખતે તાત્કાલિક કઈ સારવારની ભલામણ છે :
- (A) હાઈડ્રોથેરેપી (B) આઈસ થેરેપી
(C) હીટ થેરેપી (D) આમાંથી કોઈ નહીં
41. Olympic games were not held in the year 1948 :
- (A) True (B) False
(C) Partly true (D) Partly false
- ૧૯૪૮ માં ઓલિમ્પિક રમતોત્સવ યોજાયો ન હતો :
- (A) સાચુ (B) ખોટુ
(C) આંશિક સાચુ (D) આંશિક ખોટુ

42. Philosophy deals with social traditions :

- (A) True (B) False
(C) Partly true (D) Partly false

ફિલોસોફી સામાજિક રીતરિવાજો સાથે સંબંધ ધરાવે છે :

- (A) સાચુ (B) ખોટું
(C) આંશિક સાચુ (D) આંશિક ખોટું

43. Parabola is path of the object formed in the air :

- (A) True (B) False
(C) Partly true (D) Partly false

પેરાબોલા હવામાં પદાર્થ બનાવેલ રસ્તો છે :

- (A) સાચુ (B) ખોટું
(C) આંશિક સાચુ (D) આંશિક ખોટું

44. Duration of the Basket-ball match is :

15-2_15-15_15-2_15

- (A) True (B) False
(C) Partly true (D) Partly false

બાસ્કેટબોલનો રમત સમય ૧૫-૨_૧૫-૧૫_૧૫-૨_૧૫ છે :

- (A) સાચુ (B) ખોટું
(C) આંશિક સાચુ (D) આંશિક ખોટું

45. Make the correct choice from the Assertion (A) and Reason (R) given below :

Assertion (A) : Before independence there was not a single Physical Education College in India.

Reason (R) : Y.M.C.A. started Physical Education College in Madras (Chennai) in 1920.

Select the correct answer from the codes given below :

- (A) Both (A) and (R) are true and (R) is the correct explanation of (A)
(B) Both (A) and (R) are true but (R) is not the correct explanation of (A)

(C) (A) is true but (R) is false

(D) (A) is false but (R) is true

નીચે આપેલ વિધાન (A) અને તે માટે જણાવેલ કારણ (R) માંથી સાચો વિકલ્પ શોધો :

વિધાન (A) : સ્વતંત્રતા પહેલા ભારતમાં એક પણ શારીરિક શિક્ષણની કોલેજ હતી નહિં

કારણ (R) : વાય.એમ.સી.એ.દ્વારા ૧૯૨૦ માં મદ્રાસ (ચેન્નાઈ) માં શારીરિક શિક્ષણની

કોલેજ શરૂ કરવામાં આવી

નીચે આપેલ કોડમાંથી સાચો જવાબ શોધો :

- (A) (A) અને (R) બન્ને સાચા છે. (R) એ (A) નું સાચું સ્પષ્ટીકરણ છે
(B) (A) અને (R) બન્ને સાચા છે પરંતુ (R) એ (A) નું સાચું સ્પષ્ટીકરણ નથી
(C) (A) સાચુ છે પરંતુ (R) ખોટું છે
(D) (A) ખોટું છે પરંતુ (R) સાચુ છે

46. Make the correct choice from the Assertion (A) and Reason (R) given below :

Assertion (A) : Muscles are machines that convert Chemical energy into Mechanical Work.

Reason (R) : Skeletal muscles are called voluntary muscles.

Select the correct answer from the codes given below :

- (A) Both (A) and (R) are true and (R) is the correct explanation of (A)
- (B) Both (A) and (R) are true but (R) is not the correct explanation of (A)
- (C) (A) is true but (R) is false
- (D) (A) is false but (R) is true

નીચે આપેલ વિધાન (A) અને તે માટે જણાવેલ કારણ (R) માંથી સાચો વિકલ્પ શોધો :

વિધાન (A) : સ્નાયુ એ યંત્ર છે જે કેમીકલ એનર્જીને મેકેનીકલ વર્કમાં રૂપાંતર કરે છે

કારણ (R) : સ્કેલેટલ મશ્સને ઐચ્છિક સ્નાયુ કહેવામાં આવે છે

નીચે આપેલ કોડમાંથી સાચો જવાબ શોધો :

- (A) (A) અને (R) બન્ને સાચા છે. (R) એ (A) નું સાચું સ્પષ્ટીકરણ છે
- (B) (A) અને (R) બન્ને સાચા છે પરંતુ (R) એ (A) નું સાચું સ્પષ્ટીકરણ નથી
- (C) (A) સાચુ છે પરંતુ (R) ખોટું છે
- (D) (A) ખોટું છે પરંતુ (R) સાચુ છે

Note :— Answer the questions 47 to 50 by matching List I with List II and select the correct answer using the codes given below the lists.

સૂચના : પ્રશ્ન નંબર ૪૭ થી ૫૦ ના જવાબો યાદિ-I ને યાદિ-II સાથે જોડી કોડમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ જણાવો.

47.

List I

List II

- | | | | |
|-----|--|-----|---------|
| (a) | Sports Authority of India | (1) | Gwalior |
| (b) | Lakshmibai National Institute
of Physical Education | (2) | Delhi |
| (c) | Y.M.C.A. College of Physical
Education | (3) | Patiala |
| | | (4) | Jaipur |
| | | (5) | Chennai |
| (d) | Netaji Subhash Institute of Sports | | |

Code :—

	(a)	(b)	(c)	(d)
(A)	(1)	(2)	(3)	(4)
(B)	(4)	(1)	(5)	(3)
(C)	(5)	(4)	(2)	(1)
(D)	(2)	(1)	(5)	(3)

યાદિ-I

યાદિ-II

- | | | | |
|-----|--|-----|----------|
| (a) | સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા | (1) | ગ્વાલીઅર |
| (b) | લક્ષ્મીબાઈ નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ
ફિઝિકલ એજ્યુકેશન | (2) | દિલ્હી |
| (c) | વાય.એમ.સી.એ. કોલેજ ઓફ
ફિઝિકલ એજ્યુકેશન | (3) | પતિયાલા |
| | | (4) | જયપુર |
| | | (5) | ચેન્નાઈ |
| (d) | નેતાજી સુભાષ ઈન્સ્ટીટ્યુટ ઓફ સ્પોર્ટ્સ | | |

કોડ :

	(a)	(b)	(c)	(d)
(A)	(1)	(2)	(3)	(4)
(B)	(4)	(1)	(5)	(3)
(C)	(5)	(4)	(2)	(1)
(D)	(2)	(1)	(5)	(3)

48.

List I

- (a) Anatomy
- (b) Physiology
- (c) Psychology
- (d) Anthropometry

List II

- (1) Measurement of body
- (2) Structure of body
- (3) Movement of body
- (4) Science of behaviour
- (5) Functions of body

Code :—

	(a)	(b)	(c)	(d)
(A)	(2)	(5)	(4)	(1)
(B)	(3)	(2)	(1)	(4)
(C)	(1)	(2)	(3)	(5)
(D)	(2)	(3)	(5)	(1)

યાદિ-I

- (a) એનેટોમી
- (b) ફિઝિયોલોજી
- (c) સાયકોલોજી
- (d) એન્થ્રોપોમેટ્રી

યાદિ-II

- (1) શરીરનું માપન
- (2) શરીરની રચના
- (3) શરીરનું હલન-ચલન
- (4) વર્તનનું વિજ્ઞાન
- (5) શરીરનું કાર્ય

કોડ :

	(a)	(b)	(c)	(d)
(A)	(2)	(5)	(4)	(1)
(B)	(3)	(2)	(1)	(4)
(C)	(1)	(2)	(3)	(5)
(D)	(2)	(3)	(5)	(1)

49.

List I

- (a) Football
- (b) Hockey
- (c) Tennis
- (d) Badminton

List II

- (1) Uber Cup
- (2) Santosh Trophy
- (3) Wimbaldon
- (4) Agakhan Cup
- (5) Ranjit Trophy

Code :—

	(a)	(b)	(c)	(d)
(A)	(5)	(4)	(1)	(2)
(B)	(1)	(2)	(3)	(4)
(C)	(4)	(3)	(1)	(5)
(D)	(2)	(4)	(3)	(1)

यादृ-1

- (a) कुटभोल
- (b) डोक्री
- (c) टेनीस
- (d) बेडमिंटन

यादृ-11

- (1) उबेर कप
- (2) संतोष ट्रोफी
- (3) विम्बल्डन
- (4) आगखान कप
- (5) रणजि ट्रोफी

कोड :

	(a)	(b)	(c)	(d)
(A)	(5)	(4)	(1)	(2)
(B)	(1)	(2)	(3)	(4)
(C)	(4)	(3)	(1)	(5)
(D)	(2)	(4)	(3)	(1)

50.

List I

- (a) FIFA
- (b) AAFI
- (c) FINA
- (d) VFI

List II

- (1) Swimming
- (2) Archery
- (3) Athletics
- (4) Volleyball
- (5) Football

Code :—

	(a)	(b)	(c)	(d)
(A)	(5)	(3)	(1)	(4)
(B)	(1)	(2)	(3)	(4)
(C)	(2)	(5)	(4)	(3)
(D)	(1)	(4)	(5)	(2)

યાદિ-I

- (a) એફ.આઈ.એફ.એ.
- (b) એ.એ.એફ.આઈ.
- (c) એફ.આઈ.એન.એ.
- (d) વી.એફ.આઈ.

યાદિ-II

- (1) સ્વીમીંગ
- (2) આર્ચરી
- (3) એથલેટીક્સ
- (4) વોલીબોલ
- (5) ફુટબોલ

કોડ :

	(a)	(b)	(c)	(d)
(A)	(5)	(3)	(1)	(4)
(B)	(1)	(2)	(3)	(4)
(C)	(2)	(5)	(4)	(3)
(D)	(1)	(4)	(5)	(2)

ROUGH WORK

ROUGH WORK

SEAL